



ધી વેરાવળ પીપલ્સ કો-ઓપ. બેંક લી.

વહીવટી ઓફીસ : 'વૃંદાવન', શુભમ ટાવર્સ સામે, બસ સ્ટેશન પાસે, વેરાવળ.

☎ ૨૨૧૨૦૧, ૨૪૪૧૨૨ ફેક્સ : ૨૪૪૧૨૩

✉ headoffice@vpcbank.com – www.vpcbank.com

**કોર બેંકીંગ સુવિધાથી સજ્જ, SMS ALERT, MISS CALL બેલેન્સ ક્વેરી, Mobile App.,
Rupay ATM / Debit Card, UPI, IMPS, QR Code વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ...**

રજીસ્ટ્રેશન નં. ૩૧૩૬ તા.૩૧-૧૦-૧૯૫૯

રીઝર્વ બેંક લાયસન્સ નં. UBD. GJ 811 P તા.29-12-1986

૬૬મો વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૦૨૫

નોટીસ

આથી બેંકના સભાસદોને જાણ કરવામાં આવે છે કે, બેંકની ૬૬મી વાર્ષિક સાધારણ સભા તા.૦૭.૦૮.૨૦૨૫ ગુરુવાર ના રોજ સાંજના ૭.૩૦ કલાકે ભારત વિકાસ પરિષદ સંચાલિત, પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્પ્યુનીટી હોલ, નવા ડાભોર રોડ, વેરાવળ મુકામે નીચે જણાવેલ કામકાજ કરવા માટે મળશે જેમાં સર્વે સભાસદોને સમયસર હાજર રહેવા વિનંતી છે.

કાર્યસૂચિ

૧. ગત તા.૧૭.૦૭.૨૦૨૪ ની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબત.
 ૨. સને ૨૦૨૪-૨૦૨૫ નાં ઓડિટેડ નાણાંકીય પત્રકો, ઓડિટ દુરસ્તી તથા વ્યવસ્થાપક સમિતિનો અહેવાલ વિચારણામાં લઈ બહાલ રાખવા બાબત.
 ૩. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભલામણ કરેલ અહેવાલના વર્ષના નફાની ફાળવણી મંજૂર કરવા બાબત
 ૪. સને ૨૦૨૫-૨૦૨૬ના વર્ષ માટે સ્ટેચ્યુટરી ઓડીટર્સની નિમણૂંકની નોંધ લેવા બાબત
 ૫. પેટાનિયમ સુધારા-વધારા બાબત
 ૬. તા.૩૦.૦૬.૨૦૨૫ ના રોજ વ્યવસ્થાપક સમિતિ દ્વારા કરવામાં આવેલ નિર્ણયો અંગેના ઠરાવો સામાન્ય સભામાં બહાલી અર્થે રજૂ કરવા બાબત
 ૭. ચેરમેનશ્રીની મંજૂરીથી અન્ય આવશ્યક કામકાજ બાબત.
- બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી..**
તા. ૨૩.૦૭.૨૦૨૫

(પરેશ એન. રાયમગીયા)

જનરલ મેનેજર CEO (I/C)

ધી વેરાવળ પીપલ્સ કો-ઓપ.બેંક લી. વેરાવળ

નોંધ

- ૧) સંક્ષિપ્ત વાર્ષિક અહેવાલની નકલ સાધારણ સભામાં સાથે લાવવા વિનંતી છે.
- ૨) સાધારણ સભામાં સભ્યોને ઓળખકાર્ડ સાથે લાવવા વિનંતી છે.
- ૩) સભા અધ્યક્ષની મંજૂરી સિવાય ઉપરમાં જણાવેલ એજન્ડા સિવાય અન્ય કોઈપણ પ્રકારની ચર્ચા હાથ ધરવામાં આવશે નહીં.
- ૪) તા.૨૯-૦૯-૯૬ ની વાર્ષિક સાધારણ સભાએ મંજૂર કરેલ ઠરાવ અનુસાર આ નોટીસથી અહેવાલના વર્ષના સંક્ષિપ્ત નાંણાંકીય હિસાબો મોકલેલ છે. આમ છતાં જે કોઈ સભાસદોને વિશેષ માહિતીની આવશ્યકતા હોય તેઓને વિસ્તૃત વાર્ષિક અહેવાલ બેંકની વેબસાઈટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકશે.
- ૫) બેંકના અહેવાલ વર્ષના વાર્ષિક હિસાબોના સંક્ષિપ્ત અહેવાલ આ નોટીસથી મોકલાયેલ છે. વિસ્તૃત વાર્ષિક અહેવાલની નકલ લેખિત માંગણી કર્યેથી ૩૦૩ બેંકની કચેરીએથી ઉપલબ્ધ રહેશે તેમજ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે. જેના ઉપરાંત સભાસદશ્રીઓ ગુજરાત રાજ્ય સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૩૩ના પ્રાવધાન મુજબની જ માહિતી મેળવવા હક્કદાર છે જેની ખાસ નોંધ લેશે.

અલ્પાહારનો સમય : સાંજના ૬-૩૦ થી ૭-૩૦ કલાક સુધીનો રાખવામાં આવેલ છે.

જેથી તે સમય દરમિયાન સર્વ સભાસદશ્રીઓને અલ્પાહારનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.

કુલ આવક, કુલ જાવક જોગવાઈઓ અને નફો

૨૩-૨૪ (₹ લાખમાં)

૨૪-૨૫ (₹ લાખમાં)

કુલ આવક

૩૬૨૮.૫૮

૩૮૬૧.૮૫

કુલ જાવક

૨૯૦૭.૩૪

૩૦૯૯.૭૫

ગ્રોસ નફો

૭૨૧.૨૪

૭૬૨.૧૦

જોગવાઈઓ

૨૦૫.૬૯

૨૨૩.૯૨

કાર્યકારી ચોખ્ખો નફો સરવૈયામાં લઈ જતા.....

૫૧૫.૫૫

૫૩૮.૧૯

બેંકની પ્રગતિના આંકડા

(₹ લાખમાં)

અનુ. નં.	વિગત	વર્ષ				
		૨૦૨૦-૨૧	૨૦૨૧-૨૨	૨૦૨૨-૨૩	૨૦૨૩-૨૪	૨૦૨૪-૨૫
૧	સભાસદ સંખ્યા	૩૧૩૩૪	૩૧૪૪૪	૩૧૫૧૧	૩૧૫૩૧	૩૧૬૩૪
૨	શેર ભંડોળ	૭૮૪.૩૪	૭૯૩.૫૦	૮૯૭.૪૦	૯૯૮.૩૪	૧૦૪૦.૮૬
૩	રિઝર્વ તથા અન્ય ફંડ	૨૨૮૯.૬૬	૨૪૯૨.૮૪	૪૧૦૭.૮૯	૪૪૩૬.૧૪	૪૮૦૨.૪૬
૪	થાપણ	૩૪૩૪૭.૯૩	૩૫૫૭૫.૭૬	૩૬૮૦૦.૬૬	૩૭૯૪૪.૩૦	૩૯૧૯૧.૦૦
૫	ધિરાણ	૧૮૦૫૦.૦૫	૧૭૨૩૬.૯૬	૧૯૪૧૪.૬૧	૨૧૧૧૦.૨૩	૨૨૬૧૦.૫૫
૬	કામકાજનું ભંડોળ	૩૮૮૫૬.૭૩	૪૦૪૮૭.૨૭	૪૩૪૭૪.૪૦	૪૫૪૬૨.૨૭	૪૭૧૭૩.૬૪
૭	નફો	૩૦૧.૦૦	૪૧૫.૦૦	૪૭૫.૧૧	૫૧૫.૫૫	૫૩૮.૧૯
૮	નેટ એન.પી.એ.%	૦.૦૫%	૦ (ઝીરો)	૦ (ઝીરો)	૧.૮૦%	૦ (ઝીરો)
૯	ઓડીટ વર્ગ	અ	અ	અ	અ	અ

નફો તથા ફાળવણી

બેંકનો કાર્યો નફો રૂ.૭૬૨.૧૦ લાખ જેમાંથી ઇન્વેસ્ટમેન્ટ ફલ્કચ્યુએશન ૪૩.૬૬ લાખ સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ (EX.IDR) ૧૪.૫૫ લાખ, જનરલ પ્રોવિઝન અગેન્સ્ટ સ્ટાન્ડર્ડ એસેટ ૩.૭૦ લાખ, ભરવાપાત્ર ઇન્કમેટેક્સ, પ્રોવિઝન સને ૨૦૨૪-૨૦૨૫ ના રૂ.૧૬૨.૦૦ લાખ ચુકવણી કર્યા બાદ ચોખ્ખો નફો રૂ.૫૩૮.૧૯ લાખ નો થયો છે. જેની વહેંચણી નીચે પ્રમાણે મંજૂર રાખવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આજની સભાને ભલામણ કરે છે.

૧	પેટા નિયમ ૪૪ અ મુજબ અનામત ભંડોળ ખાતે ૨૫% મુજબ	૧,૩૪,૫૪,૭૮૧.૦૦
૨	સહકારી કાયદાની સુધારેલી કલમ ૬૭-૬ મુજબ કુલત અને શંકાસ્પદ લેણા અનામત ખાતે ૧૫% મુજબ	૮૦,૭૨,૮૬૯.૦૦
૩	પેટા નિયમ ૪૪-૬ મુજબ શેર ભંડોળ ઉપર ૧૩% ડિવીડન્ડ	૧,૩૨,૭૭,૭૭૪.૦૦
૪	પેટા નિયમ ૪૪-૬ મુજબ શિક્ષણ ફાળો	૩,૦૦,૦૦૦.૦૦
૫	પેટા નિયમ ૪૪-બ મુજબ મેમ્બર્સ બેનીફીટ ફંડ	૪,૦૦,૦૦૦.૦૦
૬	પેટા નિયમ ૪૪-ઇ-૧ મુજબ ચેરીટી ફંડ	૫,૦૦,૦૦૦.૦૦
૭	પેટા નિયમ ૪૪-ઇ-૧ મુજબ સ્ટાફ બેનીફીટ ફંડ	૭,૦૦,૦૦૦.૦૦
૮	પેટા નિયમ ૪૪-ઇ-૪ મુજબ બિલ્ડીંગ ફંડ	૫૦,૦૦,૦૦૦.૦૦
૯	પેટા નિયમ ૪૪-ઇ-૧ મુજબ સહકાર, પ્રચાર શિક્ષણ ફંડ	૨૫,૦૦૦.૦૦
૧૦	ઇન્વેસ્ટમેન્ટ ફલ્કચ્યુએશન ફંડ ખાતે (રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઇન્વેસ્ટમેન્ટ અંગેના માસ્ટર સરક્યુલર પારા નં.૧૮માં સુચવ્યા મુજબ)	૧,૦૦,૦૦,૦૦૦.૦૦
૧૧	સાચબર સિક્યુરીટી ફંડ ખાતે	૨૦,૮૮,૬૯૯.૩૪
	કુલ રૂપીયા	૫,૩૮,૧૯,૧૨૩.૩૪

ડિવીડન્ડ :- બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સભાસદોને અહેવાલના વર્ષ માટે ૧૩% લેખે ડિવીડન્ડ આપવાની ભલામણ કરે છે. તે સ્વીકારી બહાલ રાખવા વિનંતી..

વિમા કવચ : બેંકની તમામ થાયણો સામે રિઝર્વ બેંકના નિયમ અનુસાર બેંક દ્વારા છ માસે નિયમિત રીતે ભરવાપાત્ર પ્રિમીયમ ભરાયેલ છે. જેના કારણે થાપણદારોની ₹ ૫ લાખ સુધીની થાપણો વિમા કવચ હેઠળ સુરક્ષિત છે.

ધી વેરાવળ પીપલ્સ કો-ઓપ. બેંક લી

(રકમ રૂ લાખમાં)

તા. ૩૧ માર્ચ ૨૦૨૫ નાં રોજનું સંક્ષિપ્ત સરવૈયું

૩૧-૩-૨૦૨૪	ભંડોળ-દેવું	૩૧-૩-૨૦૨૫	૩૧-૩-૨૦૨૪	મિલ્કત-લેણું	૩૧-૩-૨૦૨૫
૯૯૮.૩૪	વસુલ આવેલ શેરભંડોળ	૧૦૪૦.૮૬	૧૧૯૮.૯૯	હાથ ઉપર રોકડ	૧૧૫૪.૭૬
૪૪૩૬.૧૪	રિઝર્વ ફંડ તથા અન્ય ફંડ	૪૮૦૨.૪૬	૨૪૬૧.૨૦	નોટીફાઈડ બેંકોમાં ચાલુ ખાતે	૨૬૯૫.૫૮
૩૭૯૪૪.૩૦	થાપણો	૩૯૧૯૧.૦૦	૭૪૬.૫૯	અન્ય બેંકોમાં ચાલુ ખાતે	૧૩૯૯.૩૪
૦	કરજ	૦	૨૧૪૭.૬૭	બેંકોમાં મુદતી થાપણો	૨૮૮૦.૧૨
૦	વસુલાત માટેના બીલ્સ	૦	૧૫૦૦૦.૮૯	રોકાણો	૧૩૫૭૩.૧૨
૦	બ્રાંચ એડજસ્ટમેન્ટ	૦	૨૧૧૧૦.૨૩	ધિરાણ	૨૨૬૧૦.૫૫
૭૦૮.૬૮	મુદતવિતી વ્યાજ અંગે રિઝર્વ	૬૧૯.૭૪	૧.૭૮	બ્રાંચ એડજસ્ટમેન્ટ	૧.૭૮
૬૧૮.૨૦	ચુકવવાપાત્ર વ્યાજ	૭૧૮.૧૯	૮૩૧.૬૬	મળવાપાત્ર વ્યાજ	૯૨૫.૮૯
૨૪૧.૦૫	અન્ય જવાબદારી	૨૬૩.૨૦	૦	વસુલાત માટેના બિલ્સ	૦.૦૦
૫૧૫.૫૫	નફા-નુકશાન ખાતે	૫૩૮.૧૯	૧૫૫૩.૪૫	સ્થાવર મિલ્કતો	૧૫૧૪.૬૨
			૧૦૧.૯૩	ઈર્નિયર અને ફીક્ચર્સ	૧૪૪.૪૨
			૩૦૭.૮૭	અન્ય અસ્કયામતો	૨૭૩.૪૬
૪૫૪૬૨.૨૬	કુલ સરવાળો	૪૭૧૭૩.૬૪	૪૫૪૬૨.૨૬	કુલ સરવાળો	૪૭૧૭૩.૬૪

તા. ૩૧ માર્ચ ૨૦૨૫ નાં રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું (રકમ રૂ લાખમાં)

૩૧-૩-૨૦૨૪	ખર્ચ	૩૧-૩-૨૦૨૫	૩૧-૩-૨૦૨૪	આવક	૩૧-૩-૨૦૨૫
૨૦૩૭.૪૩	થાપણ તથા કરજ ઉપર વ્યાજ	૨૨૮૪.૪૨	૩૩૮૮.૬૮	વ્યાજ અને વટાવ	૩૪૩૪.૯૩
૬૧૮.૪૨	પગાર ખર્ચ	૫૩૫.૧૫	૩૮.૧૮	કમિશન - દલાલી	૩૬.૩૯
૬૮.૬૩	ભાડુ,કર,પિમો તથા ઇલે.ખર્ચ	૭૧.૭૪	૦	સીક્યોરીટી ના વેચાણથી	૦
૧.૮૫	કોર્ટ - વકીલ ફી	૮.૯૪		થયેલ આવક	
૬.૧૬	પોસ્ટેજ,ટપાલ, ટેલીફોન ખર્ચ	૬.૮૩	૧૫૬.૦૩	અન્ય આવક	૧૪૭.૬૮
૬.૭૧	ઓડીટ ફી	૭.૮૧	૪૫.૬૯	વધારાનુ આઈ.ડી.આર.નુ	૫૮.૨૨
૨૪.૦૨	મિલ્કત મરામત તથા ઘસારા ખર્ચ	૨૯.૦૭		પ્રોવીઝન	
૧૧.૨૫	સ્ટેશનરી છાપકામ અને જાહેરાત	૧૦.૯૩	૦	વધારાનુ એન.પી.એ.વ્યાજ	૧૮૪.૬૩
૧૩૨.૮૬	અન્ય ખર્ચ	૧૪૪.૮૫		પ્રોવિઝન	
૪૫.૬૯	જોગવાઈ	૬૧.૯૨			
૧૬૦.૦૦	આવક વેરો	૧૬૨.૦૦			
૫૧૫.૫૫	નફો સરવૈયામાં લઈ જતા	૫૩૮.૧૯			
૩૬૨૮.૫૮	કુલ સરવાળો	૩૮૬૧.૮૫	૩૬૨૮.૫૮	કુલ સરવાળો	૩૮૬૧.૮૫

૦	ટ્રાન્સફર બી.ડી.ડી.આર.	૩૧૮.૨૫		નેટ નફો	૫૩૮.૧૯
૦	નેટ નફો	૫૩૮.૧૯		સ્પે.બી.ડી.ડી.આર. (ગ્રો.ઓપ.સો.૬૭ ટ)	૩૧૮.૨૫
	સરવાળો	૮૫૬.૪૪			૮૫૬.૪૪

**બોર્ડ
ઓફ
ડિરેક્ટર્સ**
AS on
31.3.2025

- શ્રી પ્રકાશભાઈ જગજીવનદાસ તન્ના -ચેરમેન
- શ્રી રમેશચંદ્ર દ્રારકાદાસ ઠક્કર -મેને. ડિરેક્ટર
- શ્રી ચિરાગભાઈ વિનોદરાય કારીયા -જો.મેને.ડિરેક્ટર (તા.૩૦.૦૬.૨૫ સુધી)
- શ્રી ઉપેન્દ્રભાઈ રમણીકલાલ તન્ના -ડિરેક્ટર
- શ્રી રમેશચંદ્ર જમનાદાસ ગંગદેવ -ડિરેક્ટર
- શ્રી ભદ્રેશભાઈ જમનાદાસ દાવડા -ડિરેક્ટર
- શ્રી સંદિપભાઈ પ્રજલાલ રાયઠ્ઠા -ડિરેક્ટર
- શ્રી જતીનભાઈ ચંદુલાલ રાજા -ડિરેક્ટર
- શ્રી મુકેશભાઈ રસીકલાલ રૂપારેલીયા -ડિરેક્ટર

- શ્રીમતી ચંદ્રિકાબેન વિનોદરાય કારીયા -ડિરેક્ટર (તા.૩૦.૦૬.૨૫ સુધી)
- શ્રીમતી ભારતીબેન કિશોરકુમાર ચંદ્રાણી -ડિરેક્ટર
- શ્રી હરેશભાઈ હીરાભાઈ ચોપડા - ડિરેક્ટર
- શ્રીમતી જયશ્રીબેન અશ્વિનભાઈ ઉનડકટ -ડિરેક્ટર,તાલાલા
- શ્રી પારૂલભાઈ પોપટભાઈ કારીયા -ડિરેક્ટર,કેશોદ
- શ્રી હરીશચંદ્ર હરજીવનભાઈ રૂપારેલીયા -ડિરેક્ટર,માંગરોળ
- શ્રી જયેશકુમાર નારણદાસ ગદા -ડિરેક્ટર,જુનાગઢ
- શ્રી દિનેશચંદ્ર ઘીરજલાલ દેવાણી -પ્રો. ડિરેક્ટર
- શ્રી ભૂવનેશભાઈ છગનલાલ કક્કડ -પ્રો. ડિરેક્ટર

શ્રી પરેશભાઈ નવીનચંદ્ર રાયમગીયા - જનરલ મેનેજર CEO (I/C)

પેટા નિયમ સુધારા-વધારા દરખાસ્ત

ક્રમ		જૂના પેટા નિયમ	નવા પેટા નિયમ	કારણો
૦૧	૪૪ (ઈ) (૭)	કુલ ભરપાઈ થયેલ શેર ભંડોળ ઉપર બે ટકાથી વધુ નહીં તેટલી રકમ ડિવિડન્ડ ઇન્કવીલાઈઝશન ફંડ ખાતે જેતે વર્ષમાં લઈ જઈ શકાશે આ ખાતે કુલ ભરપાઈ થયેલ શેર ભંડોળના વધુમાં વધુ ૧૨ ટકા સુધી રકમ આવી ફાળવણી કર્યા બાદ થાય ત્યાં સુધી જ લઈ જવામાં આવશે.	૨૬ કરવો.	રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સૂચનાઓ મુજબ અમલ કરવાનો હોવાથી

સભાસદો જોગ વિશેષ-પિનામૂલ્યે રૂ.૨,૦૦,૦૦૦/-નો અકસ્માત વિમો

બેન્ક દ્વારા હવે તમામ વ્યક્તિ સભાસદોને 'ગ્રુપ પર્સનલ એક્સીડન્ટ પોલિસી' હેઠળ કવરેજ આપી રૂપિયા બે લાખ પુરાની રકમનું અકસ્માત વિમા વળતર મળી રહે તે હેતુથી ઓરીયન્ટ ઇન્સ્યુરન્સ કું. સાથે વ્યવસ્થા ગોઠવેલ છે. સદરહુ અકસ્માત વિમા હેતુ વ્યક્તિ સભાસદની ઉંમર ૧૮ થી ૭૫ વર્ષની રહેશે. સદરહુ સભાસદો માટેના વિમાની મુદત વધુ ૧ વર્ષ માટે રીન્યુ કરી આવશ્યક પ્રીમીયમની રકમ ભરી આપવામાં આવેલ છે. સભાસદશ્રીઓને આ અકસ્માત વિમા વળતરનો લાભ વ્યક્તિત્વ દ્વારા કંપનીના ધારાધોરણને અનુસરીને મળવાપાત્ર રહેશે. જેની આથી સર્વે સભાસદો જોગ સહર્ષ જાહેરાત કરીએ છીએ. સભાસદશ્રીઓને વિનંતી છે કે, તેઓ પોતાના જરૂરી KYC ડોક્યુમેન્ટની નકલો બેન્કની લાગુ પડતી કચેરીએ રજુ કરી પોતાની પ્રોફાઇલ અપડેટ કરાવવા વિનંતી.

સભાસદો /ગ્રાહકો જોગ નમ્ર નિવેદન

બેન્ક દ્વારા ઇશ્યુ કરાયેલ આપના ATM CUM DEBIT કાર્ડના નંબર, CVV નંબર, OTP, ATM, PIN, MOBILE APP. PIN વગેરે કોઈને પણ જણાવશો નહીં. બેંકના કર્મચારીઓ ક્યારેય આવી માહિતી માંગતા નથી. ટેકનોલોજી આધારીત ગુન્હાઓની વધતી જતી સંખ્યાઓને ધ્યાને લઈ થોડી સાવચેતી રાખવાથી થનાર મોટા નુકશાનથી બચી શકાશે. આપ પાસેથી બેન્કના નામે આવી કોઈપણ વિગતો ફોન પર માંગવામાં આવે તો તુરંત બેન્કની લાગુ પડતી કચેરીનો સંપર્ક કરી યોગ્ય જાણ કરશો.

ગ્રાહકો/સભાસદો જોગ વિશેષ ખાસ સુચના કે, જે સભાસદ/ગ્રાહક બેન્ક સાથેના તેઓના વ્યવહાર, માહિતીની આપલે તેમજ પત્ર વ્યવહાર ઇ-મેઇલ દ્વારા કરવા ઇચ્છુક હોય તેઓએ લાગુ પડતી શાખાની મુલાકાત લઈ પોતાનું ઇ-મેઇલ એડ્રેસ રજીસ્ટર કરાવવા ઘટતી કાર્યવાહી કરવી. બેન્કના રેકર્ડ પર નહીં નોંધાયેલા હોય તેવા કોઈપણ ઇ-મેઇલ એડ્રેસ પરથી થયેલા કોમ્યુનિકેશનને ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ સભાસદો/ગ્રાહકોએ લેવા વિનંતી છે.

સભાસદો જોગ ડિવિડન્ડ અંગે ખાસ અનુરોધ

બેન્ક દ્વારા જાહેર કરાયેલા ડિવિડન્ડને જાહેર કર્યાની તારીખથી ત્રણ વર્ષની મુદતમાં વટાવવામાં નહીં આવે તો તે ડિવિડન્ડની વણચૂકવાયેલ રકમ નિયમાનુસાર બેન્કના રીઝર્વ ભંડોળ ખાતે જમા લઈ જવામાં આવશે. સભાસદશ્રીઓને વિશેષ અનુરોધ છે કે, બેન્ક દ્વારા જાહેર કરાતા/ચુકવાતા ડિવિડન્ડની રકમ સીધી પોતાના ખાતામાં જમા મેળવવા હેતુ બેન્કની લાગુ પડતી કચેરીની મુલાકાત લઈ પોતાના ખાતાની વિગતો શેર વિભાગમાં અપડેટ કરાવવા વિનંતી છે.

ખાસ સુચના

બેન્કના અહેવાલના વર્ષના ઓડીટરશ્રી દ્વારા ચકાસાયેલા અને પ્રમાણિત કરેલા વાર્ષિક હિસાબો નિયમાનુસાર પ્રસિધ્ધ કરાયેલ છે. જેનું વ્યક્તિગત રીતે સત્યથી વેગળું તેમજ ભ્રામક, ખોટું અને સંસ્થાની માનહાની કરતું વિશ્લેષણ કરી સોશીયલ મીડીયા દ્વારા કે અન્ય રીતે ચર્ચાઓ કરી સંસ્થાના હિતોને નુકશાન પહોંચાડવાની પ્રવૃત્તિ કરનાર/કરાવનાર સભાસદશ્રી કે અન્ય ની સામે બેન્કે લાગુ પડત કાયદાના પ્રાવધાનો અંતર્ગત પગલા લેવાની ફરજ પડશે જેની ખાસ નોંધ લેશો...